

Jerry Coughlan સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર

સમુદાયની નવીનતમ માહિતી – ડિસેમ્બર 2020

બાંધકામ ચાલુ છે!

અમે આપને બહુ-અપેક્ષિત Jerry Coughlan સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર અંગે નવીનતમ માહિતી વિષે વાકેફ કરવામાં પ્રસન્ન છીએ.

નવું અત્યાધુનિક કેન્દ્ર

Jerry Coughlan સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર એક નવું, ચાર માળનું આઉટપેશન્ટ્સ (બહારના દર્દીઓ) માટે તબીબી અને સમુદાયનું સ્વાસ્થ્ય કેન્દ્ર છે જે North Pickeringમાં બાંધવામાં આવી રહ્યું છે. અને તેને આપણા વૃદ્ધિ પામતા જતા વિસ્તાર માટે એક જ સ્થળ પર અનેકવિધ હારમાળનની સ્વાસ્થ્ય સંભાળની સેવાઓને પૂરી પાડવા માટે રચવામાં આવેલું છે.

સેવાઓમાં દિવસના ભાગમાં કરાતી શસ્ત્રક્રિયાની પ્રક્રિયાઓ, એક ઈમર્જન્સી કેર ક્લિનિક તેમજ અન્ય Lakeridge સ્વાસ્થ્ય સેવાઓનો સમાવેશ થશે. ઈમારતમાં અન્ય ભાડૂતો નૈદાનિક પરીક્ષણ, લેબોરેટરીની સેવાઓ, એક દવાની દુકાન તેમજ અન્ય સલાહ આપનારા નિષ્ણાત ડોક્ટરોની ક્લિનિકોની હારમાળ પૂરી પાડશે – જે તમામ અત્યાધુનિક, સંપૂર્ણપણે દર્દી અને પારિવારિક-કેન્દ્રનાં માળખામાં સુગમતાથી પહોંચી શકાય એવી રીતે બાંધકામ કરેલું હશે. નવું કેન્દ્ર Pickeringમાં 1690 Dersan Street ખાતે આવેલું હશે તેમજ મધ્યથી લઈને મોડામાં મોડું 2022 સુધીમાં ખુલવા માટે સુનિશ્ચિત કરાયેલું છે.



નવા કેન્દ્ર માટેનાં આયોજનોની ઓગસ્ટ 2020માં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી જ્યારે Lakeridge હેલ્થ અને NorthWest Healthcare Properties REIT (NorthWest)એ સરકાર અને સમુદાયના ભાગીદારો સાથે મળીને આધિકારિક રીતે ભવિષ્યમાં બનનાર સ્થળ પર બાંધકામની પરિયોજના માટે સમારોહનું આયોજન કર્યું હતું.

આપણા સમુદાયને સહાય કરવી

North Pickering એ એવો ઝડપથી વધી રહેલો સમુદાય છે જે સમુદાય-આધારિત સ્વાસ્થ્ય સંભાળની સતત વધતી રહેતી જરૂરિયાત ધરાવે છે. નવું કેન્દ્ર એવા સંકલિત સંભાળનાં નમૂનાની વિશિષ્ટતા ધારાવશે જે સમગ્ર Durham ક્ષેત્રમાંથી દર્દીઓને ખામીરહિતપણે હોસ્પિટલ અને સમુદાય સ્વાસ્થ્ય અને ડોક્ટરની સેવાઓમાં પરિવર્તિત થવા બાબતે રાહતકારી બનાવશે જેનાંથી દર્દી અને સંભાળની ટુકડી માટેનો અનુભવ સુદૃઢ બની શકશે.



બાંધકામ ચાલુ છે

આ અઠવાડિયે બાંધકામ ખોદકામ અને સ્થળ પરનાં કામો માટે અત્યારે સ્થળ પર રાખવામાં આવેલ ભારે સાધનસામગ્રી સાથે શરૂ કરવામાં આવ્યું હતું. બાંધકામની તમામ પ્રવૃત્તિઓ સામાન્ય કામકાજનાં ક્લાકો દરમિયાન કરવામાં આવશે તેમજ સૌથી નજીક વસવાટ કરતા રહેવાસીઓ માટે સૌથી ઓછામાં ઓછી ખલેલ પહોંચાડશે.

બાંધકામનું કામ ચાલુ હોવાથી, આપણા વિકાસના ભાગીદાર NorthWest પણ એવા અન્ય સ્વાસ્થ્ય સંભાળમાં સહાયકારક બનતી સેવાઓ તેમજ સુખાકારી પ્રદાતાઓ સાથે પટા-કરારોને અંતિમ રૂપ આપવામાં વ્યસ્તપણે કામ કરી રહ્યા છે જેઓ ઈમારતમાં વસવાટ કરવાનાં છે.

ટૂંક સમયમાં આવી રહ્યું છે – લાઈવ વિડિઓ ફીડ

સ્થળ પર વીજ પુરવઠો ડિસેમ્બરની શરૂઆતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાંથી ઈન્ટરનેટ પર જીવંત વિડિઓને સક્ષમ બનાવાશે જેથી તમે જેમ-જેમ બાંધકામ ચાલતું રહે તેમ-તેમ તમે તેને જોઈ શકો.



જેમ-જેમ આ આકર્ષક પરિયોજના આગળ ધપતી જશે તેમ-તેમ અમે નિયમિતપણે નવીનતમ માહિતીથી વાકેફ કરતા રહેશું. વધુ માહિતી માટે, કૃપા કરીને Lakeridge Healthની વેબસાઈટની મુલાકાત લો અથવા infoJCHWC@lh.ca પર ઈમેઈલ કરો.



**Lakeridge
Health**

સંપર્કમાં રહો

WWW.LH.CA infoJCHWC@lh.ca



LakeridgeHealth



LakeridgeHealth